

Ahmedabad: Click Diwali pop-up, trigger fraud bomb

AHMEDABAD: A businessman from the Satellite area of the city was browsing through management ideas when a pop-up on his screen presented an attractive mutual funds offering.

He clicked the pop-up, unwittingly giving hackers access to his phone. In eight transactions, cybercrooks stole Rs 49,900 from him.

A BBA student from Ahmedabad was watching videos on a website when a pop-up laid out the prospect of meeting beautiful girls in his neighbourhood. He clicked and lost Rs 15,000 to scammers.

The pop-up traps are ensnaring a growing number of people. So the cops and the state cyber cell, which comes under the CID (crime), have



issued an advisory warning people about the risks of careless clicking.

Apart from taking your money, cybercrooks may hack into your device and snoop into your personal life.

The advisory, issued on Saturday by the state cyber cell, said: "Be cautious [about] phishing pop-up advertisements in apps. Do not download any apps with such

pop-ups." The advisory added: "Your personal content or videos can be made viral on social media."

Police said several apps give free passage to the cybercrooks into people's devices. The pop-up is a common gateway into your devices.

Even if a person inadvertently clicks on such pop-ups or links, cybercrooks can swiftly get access to the person's device and obtain crucial information, said a cop from the cyber cell.

Sometimes, the cop said, the cybercrooks also get access to a phone's video camera and record personal activities and spy on the target. Thus, the cybercrooks can extort money with the threat of leaking personal information.

Nelson Mandela Nobel Peace Award Academy facilitated Ajay Sharma, (M. D.), Moral Group of Companies



Ahmedabad, Nelson Mandela Nobel Peace Award Academy is one of the best Academies in the world whose activities are for Welfare of the Society. The Academy works for Development of the Society and also promotes the people who contribute in developing the Society. In this connection, the Academy recognized Ajay Sharma, Managing Director, Moral Group of Companies for his outstanding contributions in the field of Entrepreneurs development, Creating Employment for all, Government's Atmanirbhar Bharat Mission with Social Responsibilities. 'The Moral Group Of Companies' come a fore rendering its clients some lesson of its lives in keeping moral and morals and with morale. Having successfully commenced on a low note with economics as its base, the company now in-tunes with

more interesting phases of life - reaching out to target-audience from a platform that's moving on step-by-step by it Micro Finance, Real Estate, Software, Co-operative Society, Direct Selling, Life Insurance, Share Trading, Pharmaceuticals, FMCG, Organic Agro. Company's success is totally under leadership of Ajay Sharma with his firm Mission Slogan "Moral Jagana Hai, Bharat Banana Hai" is to synergize the strengths of togetherness and create a common learning without making any differences be it Religion or Sex or Castes since established on 5th December, 2007 and within a short period of time Moral Group of Companies presence in more than 22 states in India having 140 branches and 20 regional offices and run successfully thru Moral Foundation Trust and Moral Industries.

Shalby Hospitals commences pre-registration for Covid Vaccination for Children



Ahmedabad, Shalby Multispecialty Hospitals, one of India's leading multi-specialty hospital chains has begun pre-registration for Covid Vaccination for Children. These preregistrations are being conducted at all its 11

hospitals located across the country, with 4 hospitals in Ahmedabad (SG Highway, Krishna Shalby at Ghuma, Shalby Naroda, and Vijay Shalby) and one in each in Mumbai, Jaipur, Indore, Surat, Vapi, and Mohali. Parents can preregister their children using this link: <https://forms.gle/adWvXRTbH7nLWN7L9> or visit the nearest Shalby Hospital.

Preregistrations for children are being focused even as talks with schools and other relevant organizations and associations are underway by Shalby to build tie-ups and facilitate mass vaccinations. (13-9)

Burglars set ATM kiosk on fire after stealing Rs 31 lakh in Surat



Ahmedabad : Burglars stole Rs 31.31 lakh cash from an automated teller machine (ATM) of State Bank of India in

Vadod of Pandesara during early hours on Friday. After stealing cash, the burglars torched the machine and the ATM booth.

Along with the ATM, fixture, AC and CCTV cameras were destroyed in the fire, police said. Police were informed about the theft at around 8am. The theft is suspected to have been carried out between 12 midnight to 4 am. The ATM was out open using a gas cutter. There was no security guard employed at the ATM and none in the area came to know about the incident till the personnel of the agency managing the ATM went to check it.

WESTERN RAILWAY ELECTRONIC INTERLOCKING SYSTEM

Tender Notice No. WTRC/BRC/1168/2021-22 (Signal) Name of the Work with its location: Design, Manufacture, Installation, Procurement, Testing and Commissioning of Electronic Interlocking (EI) system by OEM conforming to attach tentative signaling plan and RDSO Specification as per RDSO/SNP/1920/19 Ver 2.0 with latest amendments. Utility Shifting of Train Operating related Equipment and S&T Equipment, Signaling Cables, Locations, Relay Room, Auto Signaling Hubs, SM Panels and supply of Indoor and Outdoor materials, trenching, laying, termination of S&T cables of various cores complete for Indoor and Outdoor works of Miyagam Karjan stations and Auto Hub no-38 Signaling Auto Hubs between Miyagam Karjan-Lakodara Section coming under proposed Tracks, Proposed Platforms, loop line at Miyagam for clearing the site for Civil work connected with Gauge Conversion Miyagam Karjan-Dadhori-Samlaya Junction Section at Vadodara Division of Western Railway. Approx Cost of the Work: ₹ 15,34,33,860.49/- EMD: Nil Validity of Offer: 120 days from the date of opening of tender Time & Date for Submission & Opening of a tender document: upto 18.00 Hrs on 23.11.2021 and opening on same date at the place of Website Particulars & Notice for Location where complete details can be seen: www.reps.gov.in (Construction), 1st floor, Annex Bldg, DMH Office, Pratishtha, Western Railway, Vadodara-390004. e-9277

Like us on Facebook.com/WesternRail

GSFC University holds its third convocation

Ahmedabad : City-based GSFC University on Sunday organized its third convocation. Chairman of Zydis Cadila Pankaj Patel was the chief guest at the convocation ceremony during which vice-chancellor Dr Nikhil

Zaveri presented the university report. University's registrar R B Panchal proposed conferment of degrees to 413 students and gold medals to eight students which was approved by GSFC University's president P. K. Taneja, IAS

(retired). Taneja said that the university has already implemented several initiatives like novel and emerging programs of study, flexibility in curriculum development, student internship, startup activities for students, bridge courses and such other value-generating initiatives as envisaged in the New Education Policy announced by the Government of India.

Patel said that there can be no greater cause than educating young minds and equipping them with the knowledge, wisdom and skills to improve and transform the world. He said that continuous learning makes a big difference. "Learn, even beyond areas of specialization, collaborate and work in a team," Patel said while urging the graduating students to be a trouble-shooter, an enabler and a creator while standing by values.

PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED
(Formerly Sirend and Shird Pharma Limited in which Praveg Communications Limited has amalgamated)
CIN: L24231GJ1995PLC024809
Registered Office: 214, Athena Avenue, Behind Jagur Showroom, S.G. Highway, Gota, Ahmedabad-382481
Website: www.praveg.com
Email: cs@praveg.com / Phone: +91 79 27496737

NOTICE

Pursuant to Regulation 29 read with 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (Listing Regulations), notice is hereby given that a meeting of the Board of Directors of the Company is scheduled to be held on **Wednesday, November 10, 2021** inter alia to consider and approve the standalone and consolidated unaudited financial results of the Company for the quarter and half-year ended September 30, 2021. The said notice may be accessed on the company's website at www.praveg.com and may also be accessed on the stock exchange's website www.bseindia.com.

For Praveg Communications (India) Limited

(Formerly known as Sirend and Shird Pharma Limited)
Place : Ahmedabad
Date : November 2, 2021
Mukesh Chaudhary
Company Secretary & Compliance Officer

GOKUL AGRO RESOURCES LIMITED

CIN: L15142GJ2014PLC080010

Regd. Office: Office No. 801-805, Dwarkesh Business Hub, Survey No. 126/1, Opp. Visamo Society, B/h Atishay Bellevue, Motera, Ahmedabad- 380005.

Statement of Standalone and Consolidated Unaudited Financial Results of the Company for the Second Quarter ended September 30, 2021

(Rs. in Lakhs except EPS)

Particulars	Standalone Financial Results			Consolidate Financial Results		
	Three months ended on 30.09.2021	Corresponding three months in the previous year ended on 30.09.2020	Year to date figures for current period ended 30.09.2021	Three months ended on 30.09.2021	Corresponding three months in the previous year ended on 30.09.2020	Year to date figures for current period ended on 30.09.2021
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited
Total Income from Operations	265,964.67	168,734.32	496,763.84	269,807.48	188,678.93	502,307.76
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	2,505.61	873.20	4,086.39	2,963.70	1,103.89	4,867.41
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	2,505.61	873.20	4,086.39	2,963.70	1,103.89	4,867.41
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	1,803.92	566.60	2,947.27	2,181.94	751.69	3,593.30
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	1,803.92	566.60	2,947.27	2,184.05	651.77	3,648.96
Equity Share Capital	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90	2,637.90
Reserves excluding Revaluation Reserves as per Balance Sheet of previous accounting year	26,158.99	20,794.82	26,158.99	31,047.97	24,297.75	31,047.97
Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)						
a) Basic (Rs.)	1.37	0.43	2.23	1.65	0.57	2.72
b) Diluted (Rs.)	1.37	0.43	2.23	1.65	0.57	2.72

Note: The above is an extract of the detailed format of Unaudited Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results is available on the Stock Exchange websites and on the website of the Company. <https://beta.bseindia.com/stock-share-price/gokul-agro-resources-ltd/gokulagro539725> and https://www.nseindia.com/live_market/dynacontent/live_watch/get_quote/getQuote.jsp?ymbo=GOKULAGRO&iliquid=0&smeflag=0&itflag=0

Notes Related to Standalone Financial Results :

- The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 02nd November, 2021.
- The above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
- The Company is mainly engaged in Agro based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard "Operating Segment" (Ind AS-108). Thus, no separate disclosure for Segment Reporting is made.
- Previous year figures have been regrouped or rearranged wherever necessary to meet with the current year's reporting requirements.

Notes Related to Consolidated Financial Results :

- The above results have been reviewed by the Audit Committee and thereafter approved and taken on record by the Board of Directors at their Meeting held on 02nd November, 2021.
- The above financial results for the quarter ended on September 30, 2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other recognized accounting practices and policies to the extent applicable.
- The Company is mainly engaged in Agro based Commodities and as such there are no separate Reportable Segment as per Indian Accounting Standard "Operating Segment" (Ind AS-108). Thus, no separate disclosure for Segment Reporting is made.
- Previous year figures have been regrouped or rearranged wherever necessary to meet with the current year's reporting requirements.

Date: 02.11.2021
Place: Ahmedabad

For & on behalf of Board of Directors of
Gokul Agro Resources Limited
Sd/-
Jayesh K. Thakkar
Managing Director

SHRIRAM HOUSING FINANCE LIMITED

Registered Office: Office No. 123, Angapalle Naicken Street, Chennai-600 001.

Head Office: Level 3, Woodhardt Towers, East Wing C-2 Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051. Website: www.shriramhousing.in

Whereas the borrowers/co-borrowers/guarantors mentioned herein had availed the financial assistance from SHRIRAM HOUSING FINANCE LIMITED. We state that despite having availed the financial assistance, the borrowers/guarantors have committed various defaults in repayment of interest and principal amounts as per due dates. The account has been classified as Non Performing Asset in accordance with the directives/guidelines issued by Reserve Bank of India, consequent to the Authorized Officer of SHRIRAM HOUSING FINANCE LIMITED under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 & in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices on respective dates mentioned herein below under Section 13(2) of SARFAESI Act, 2002 calling upon the following borrowers/guarantors/mortgagors to repay the amount mentioned in the notices together with further interest at the contractual rate at the amount mentioned in the notices and incidental expenses, cost, charges etc until the date of payment within 60 days from the date of receipt of notices.

The notices issued to them on their last known addresses and hereby informed by way of public notice about the same.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

